

શ્રીપુષ્પમંત્રાનાં લઘુણાં પુસ્તકો અમારે તાંદ્રા મળાડે

॥ શ્રીપુષ્પાય તમઃ ॥

॥ શ્રીયમુને ભલારાણ્ણીજીની જય ॥

શ્રીનડીઆદ શ્રીપુષ્પમાર્ગિય પુસ્તકાલયદારા

પ્રકાશિત અન્યમાલા. વિષયાન ૧.

શ્રીમદ્ભલાભાચાર્ય વિરચિત

॥ શ્રીયમુનાષ્ટકમ् ॥

પ્રાચીન સંસ્કૃત ટીકાઓના આધારે શુદ્ધ સરળ
ગુજરાતી ભાષાન્તર કરી

ઇપાવી પ્રકટ કરનાર,

શા. મગનલાલ બાઈજીભાઈ.

મંત્રી—શ્રીપુષ્પમાર્ગિય પુસ્તકાલય

નડીઆદ.

આવૃત્તિ ૨ ૭

સ ૧૯૭૮

પત્ર ૨૦૭૦

શ્રીવિભાગ ૪૪૫

ધી ગુજરાત પોન્ટીંગ રેસમાં શાદ. સોન્ન રિઝિસ્ટરે
ઓફિસ, ડે. પાંચહુલા, ચાર રસ્તા—અમદાવાદ.

૭૭૮૭૩

૮૪ વૈષ્ણવોની નામાવલી.

— — — — —

૧ દામોદરહાસ હરસાનીલ

૨ કૃપણુદાસ મેધન

૩ દામોદરહાસ સારસ્વતા

૪ પદ્મનાભહાસ

૫ રબેબાઇ ક્ષત્રાણી

૬ પુરુષોત્તમહાસ શોઠ

૭ રામહાસ સારસ્વત પ્રાણણુ

૮ ગદાધરહાસ કપિલ

૯ વેણુહાસ માધવહાસ

૧૦ હરિંશ પાઠક

૧૧ ગોવિદહાસ ભલ્લા

૧૨ અન્મા ક્ષત્રાણી

૧૩ ગજભનધાવન ક્ષત્રી

૧૪ નારાયણહાસ પ્રાણચારી

૧૫ એક ક્ષત્રાણી મહાવનના

૧૬ જીયહાસ ક્ષત્રી સુરતના

૧૭ દેવાકપુર ક્ષત્રી

૧૮ દિનકરહાસ શોઠ

૧૯ સુકુંદહાસ કાયસ્થ

૨૦ પ્રભુહાસ ક્ષત્રી જલોટા

૨૧ પ્રસુહાસ ભાઈ

૨૨ પુરુષોત્તમહાસ આચાના

૨૩ ત્રિપુરહાસ કાયસ્થ

૨૪ ચાહવેન્દ્રહાસ કુંભાર

૨૫ ચુલાંધ્રહાસ સારસ્વત પ્રાણણુ

૨૬ પૂર્ણમલ ક્ષત્રી

૨૭ માધવહાસ કાશ્મીરી

૨૮ ગાયાલહાસ વાંસવાડાના

૨૯ પચરાવલ સાચ્ચારા

૩૦ પુરુષોત્તમ જેશી

૩૧ જગન્નાથ જેશી

૩૨ રાણુવ્યાસ ગોધરાના

૩૩ રામહાસ સાચ્ચારા

૩૪ ગોવિદ હુવે

૩૫ રાજ હુવે માધવ હું

૩૬ ઉત્તમલેખહાસ સાચ્ચારા

૩૭ દુધર હુવે સાચ્ચારા

૩૮ વાસુદેવહાસ છકડા

૩૯ બાળવેણુ કૃપણુહાસ ઘઘરી

૪૦ જગતાનંદહાસ સારસ્વત

૪૧ આનંદહાસ વિદ્યારદાસ

૪૨ એક પ્રાણણી અદેલના

૪૩ એક ક્ષત્રાણી

૪૪ સાસુવાહુ ગોરજન ને અમરાઈ

૪૫ કૃપણુહાસ

૪૬ જુલામિત્ર

૪૭ રામહાસણ મીરાંબાઇના

પુરેહિત

૪૮ રામહાસણ ચુઙ્ગાણ

૪૯ રામાનંદ પાંડિત થાનેશ્વરના

૧૧૪૭૩

ગુજરાત વિદ્યાપીઠ ગ્રંથાલય

[ગુજરાતી કોણીરાઝિટ વિભાગ]

અનુક્રમાંક ૧૪૦૩ બાળક

પુસ્તકનું નામ ૨૧૫૩। ૮૨૫૨

વિષય પરીક્ષા: ૪૩૭

॥ श्रीकृष्णाय नमः

॥ श्रीगोपीजनवल्लभाय नमः ॥

श्रीमद्वल्लभाचार्यविरचितं ।

॥ श्रीयमुनाष्टकम् ॥

-३३३-

श्रीमहविठुलनाथशु (श्रीगुरुसांघिषु) श्रीयमुनाष्टकनी दीड़ा उत्तां प्रथम मंगलाचरणे करे हे.

विश्वोद्धारार्थमेवाऽर्बिर्भूतवृन्दावनप्रियाः ।
कृपयन्तु मदा तात्त्वरणा मयि विद्वले ॥

(श्रीमहाप्रभुठनी प्रार्थना करे हे) विश्वना उद्धारने भाटे श्रीमहाचार्य श्रीमारा उपर संहेव कृपा करे. ते श्रीमहाप्रभुठनी उवा के के प्रकट के वृंहावन तंशी पोते अभिन्न हे. ऐवी रीते कृपानी प्रार्थना करवानें अभिप्राय अवेषा हे के भागमां यथाशास्त्र श्रीयमुनाष्टकनी विवृत्ति करवानी शक्ति सिद्ध थाय, तेमज्ज आर्थीक नमन३५ मंगलाचरणे पण् थाय तेथी प्रार्थना करीने अभिप्रेत (उचित्त) जे उद्धार हे तेतो भजनानंदनी प्राप्तिः५ छे ते भजनानंद सिद्ध थवामां भक्तने हीनना अन्न साधन हे. एवुं विद्यारीने १ भक्ति २ अक्तिमां आवता प्रतिषंधना नाश उ भक्तिमां उपयुक्त पदार्थनी संपत्ति-प्राप्ति ए त्रिंशु वान अर्थज्ञानपूर्वक श्रीयमुनाष्टकना उपर्थी सिद्ध थशे एम अग्राववाने भाटे श्रीयमुनाष्टकनुं त्वर३५ तथा तेमनुं उपडारकपृष्ठं तथा कृपागुरा ए सर्वं सूचन सार्वं श्रीगुरुसांघिषु व्याख्यान करे हे.

मूलम्—नमामि यमुनामहं सकलमिद्धिहेतुं मुदा ।

मुरारिपदपंकजस्कुरदमंदरेणूल्कटाम् ॥

तटस्थनवकाननवकटमोद ॥ ४ ॥ म्बुना

सुरासुरसुपूजितस्मरपितुः श्रियं विभ्रतीम् ॥५॥

सान्वयपदार्थः— सकलसिद्धिहेतुम् सर्वं सिद्धियोने आपनां, सुरारिपदवंकजस्कुरदमंदरेणूल्कटाम् सुर नामना हेयना शत्रु (भगवान) ना चरणुकमल विष्णु प्रकाशमान अने धर्णी अवी २४ कंभां (जल कर्त्त्वां) अधिक छे. अने तटस्थनवकात्तनप्रकटमोदपुष्पाम्बुना डिनारामां रहुलां नवां वनोभां खुल्ली रीते हेयातां; इर्षाइपी कुलसहित जले इरीने सुरसुरसुपूजितस्मरपितुः सुर अने असुरोच्च सारी रीते पूजा ऐता स्मरना पिता (श्रीकृष्ण) नी शोभाने विभ्रतीम् धारणु करनारा यमुनाम् श्रीयमुनालुने अहम् हुं (श्रीवल्लभाचार्यर्थ) मुहा हप वं नमामि नमन कर्त्त्वं छ,

शास्त्रार्थ— श्रीयमुनालुने ८८ ॥ नमन कर्त्त्वं छु आप केवा हो क साक्षात् लाक्षोपयोगि हेतुप्राप्ति आहि के पुण्यमार्गीय आप प्रजारनी सिद्धि छे तेना हेतुरूप छे, अने जलना होप्रात्मक के सुर नामे हेय तेना शत्रु के श्रीकृष्ण तेमना चरणुरविदमां चणकारी अवी आधिक रैणु छे कंभां एवां श्रीयमुनालु छे (ए विशेषणुथी होप भग अने भगवत्प्राप्तिमां विलंब फूर कर्यो) वर्णी केवा छे के ए डिनाराच्चेभां रहेता एवां के नविन वन तेमां केनो गुणंध प्रउ छे एवा पुण्येयुक्त वे जग तेथो सुर अने असुरोथी पूजयेक जे स्मरपिता (भगवान) तेमनी शोभाने धारणु करवावागा छे. (आ विशेषणुथो होप निवर्त्तकपाणु अने भगवद्विषयकभाव उर प्रहृष्ट भए सुचन कर्यु) अर्थात् श्रीयमुनालुना जल हर्षनथी श्रीलगवानलु स्मरणु थाय छे अने तेमनाभां भाव उत्पन्न थाय छे.

टीका— प्रभुनी अनेक प्रजारनी लीला तहुपयुक्त वे श्रीयमुनालु तेमनी स्तुति करतां प्रथम कंभ म श्रीगोकुवेशलु अर्थात् श्रीठाकुरलुना विषयमां लव नमन शिवाय भीजुं इंधिपणु करवा समर्थ नथो तेज प्रभागे श्रीयमुनालुभां पणु एज अलिप्रायथी श्रीमहाप्रभुलु नमामि ए पदथी नमनज करे छे. हवे आठ श्लोकथी श्रीकालिंदीलुनी स्तुति करवाने अलिप्राय एवो छे के श्रीलगवाने श्रीकालिंदीलुने आठ प्रभुरसुं और्ध्वर्थ आपेलु छे, ते आठ प्रकार श्रीकुरिरायलुओ नथा

११ श्रीयमुनाष्टकनी पातानी दीक्षाओमां लभ्या छे. ते
प्रकारना अंश्वर्थं उपदेप. १ सकल सिद्धि हेतुपाणुं, २
वानमां अकित वधार्दी, ३ भगवानना संभंधमां प्रतिषंध
वाक्षी भगवानना अनुभवनी योग्यतामां के शुद्धि (पुष्टिमार्गीय
५) तेहुं के संपादन कर्तुं (दोक्ते पवित्र करवापाणुं) अबुं
तात्पर्यं ए हे के भगवाननी प्राप्तिमां के विधि आवे तेने द्वा
करीने तेने अनुभव थाय तेवी शुद्धि करनार श्रीयमुनालु हे ४
श्रीयमुनालुमां भगवानना असेअर ६ धर्मं हे तेथी विनाश्चमे
भगवाननो संभंध करवापाणुं, ५ भक्तना हातनुं निवारणु कर्तु ६
पाताना संवनथी व्रजभक्तना केवा (शुवने) भगवानना कृपापात्र करवा
७ भगवाननी केवा उपयोगि हेहुं संपादन कर्तु, ८ प्रभुना प्रस्तवेद
(श्रमजग्ग) तु जा पाताना जगमां भगेहुं हाय तेनो संभंध करवेते

मूलम्—कलिंदिगिरिमस्तके पतदमंदपूर्गोजञ्जला विलासगमनोह्लसत् प्रकटगण्डरोलोन्नता ॥

सान्वयपदार्थः—कलिंदि गिरिमस्तके, लिंद पर्वतना शिखर उपर
पतदमंदपूर्गोजञ्जला पडता एवा धण्डा प्रवाहे करीने उज्जवल (अने
विलासगमनोह्लसतप्रकटगण्डश्लोन्नता विलासपूर्वं चालवाथी शोभाय
भान अने खुल्ली रीते हेणाता गंउयोरोचे करीने उचां.

शब्दार्थः—कलिंदि नामे पर्वतना शिखर उपर पडता एव
धण्डा प्रवाहे करीने उज्जवल विलासपूर्वं चालवाथी शोभायभान
अने खुल्ली रीते हेणाती भेणी शिलाओचे करीने अतिशय उचां.

दीक्षा:—अहुं केऽपि एम शंभुं करे के नेम भीलु नहीओ हे
तेमज श्रीयमुनालु हे तो तेमां प्रथम श्लोकमां कहेली सर्वं वाप
हेम संभवे ? तो कहे हे के, श्रीमहाप्रभुलु अबुं सूचन करे हे के,
आधिद्वेषेक श्रीयमुनालुमां ए सर्वं उचिन्न छे; अने उपली
शंडा भनमां लावीने प्रयोजन कहे हे के, सुष्टि त्रणु प्रकारनी हे.
पहेली आधिद्वेषिकी, भीलु आधिद्वेषिकी, अने त्रीलु आधिद्वेष

વિક્રી. તેમાં એતો સિદ્ધ વાત છે કે આધિકૈવિકી સુપ્રિન્ટને એ
વેહ છે તેથી કે સુપ્રિ વેહાધાર છે તે આધિકૈવિકી કહેવાય
વાત ઉત્તરમીમાંસાના દેવતા વિગ્રહાધિકરણમાં “શબ્દ હતિલે
(૧-૩-૨૮) ના આખૃત્તાયમાં શ્રીમહાપ્રભુજીય બીજી અ
નિરાસ પૂર્વક સિદ્ધ કરી છે. તેથી શ્રીયમુનાજીને આધિકૈવિકી
જાણવાં; કંમંક શ્રીયમુનાજીના સ્વરૂપમાં પ્રમાણ વેહ છે તેમને
આવિજ્ઞાવ વેહમય સૂર્યથી છે. અને સૂર્ય વેહમય એ એમ ચળુ
ઓફના તૈત્તિરીય શાખાના બૃહભાષયણાપનિપથમાં ‘આદિત્યો
વા એવ એતન્મંડલંતપતિ’ એ અનુવાદમાં કહ્યું છે. અને સૂર્ય
મંડલમાં તેનેમય પુરુષાકૃતિ પરાપ્રક્રિય એ એમ વ્યાસ સૂત્રના
અધ્યાય ૧. પાદ ૧. સૂત્ર ૧૬ માં અન્તસ્તદ્વધર્મોનેદેશાત् એ એ
ધિકરણમાં નિર્ણય છે. તેમજ બૃહુહારણ્યક ઉપનિષદ્ધના પંચમ
જ્ઞાનશુભમાં ભધુવિદ્યામાં યશ્વાયમાદિત્યે તેજોમયઃ શ્રી આરંભીને
“અયમેવસ યોડયં” સુધીમાં એ પર પ્રભનું વ્યાપકપણું સિદ્ધ
કરેલું છે, એ વિના પણ અનેક પ્રમાણ છે. એ રીતે શ્રીયમુનાજીનું
આધિકૈવિકીપણું તેમજ બીજી નહીંએથી વૈક્ષણિક સિદ્ધ થયું; તેમજ
પદ્મપુરાણમાં પણ ત્રયેષા ક્રાગજુઃસામ્નામાદિત્ય ઇતિ ગોયતે તેમજ
દિવસે દિવતે ભાનુરાદાયા દાયવત્તલઃ ઉદયાચલતઃપુત્રીન ન ગત્યસ્તાચલં મુને॥
યમુનાપતતો નિત્ય ઋગવેહ, અનુર્વદ્ધ, સામવેહ એ ત્રણ વેહમય
સાક્ષાત् સૂર્ય છે. તે પોતાની પુત્રી યમુનાજીને પ્રતિદિન ઉદયાચલથી
અસ્તાચલ અને ત્યાંથી કરી ઉદયાચલ લઈ જાય છે.) ધ્રત્યાદિક
વચ્ચનોથી શ્રીયમુનાજી આધિકૈવિકી અને નિત્ય છે એમ સિદ્ધ છે.
શ્રીયમુના એ સંજ્ઞામાં કોઈ એક ધર્મ રહેલો છે અને તે રાજ એ
નામે કહેવાય છે. અને કાલિંદી એ નામનો અલિપ્રાય એ છે કે,
કલિંદ નામના પર્વતે શ્રીયમુનાજી પાસે વરદાન માર્ગું કે, હે આદિ-
ત્યનંદ્દિન! આપ મારા ઉપર કૃપા કરીને મારા શ્રિભરાહિક લાગમાં
પ્રવેશ કરીને (પૃથ્વી ઉપર) પધારો; અને તેથી આપનું કાલિંદી
ઓલું જામ કહેવાયો એ પ્રમાણે સર્વ તાત્પર્ય શ્રીમહાયાર્થચરણું

हयमां धारणु करीने क्लिंगिरि श्रियाहिक पहोवडे उपन्यास करे
छे. श्रीयमुनालु सूर्यमंडलथी प्रगट थतां भवेथी श्रेष्ठनाथी वते
छे. वणी सूर्यमंडलथी क्लिंद पर्वतना शिखर उपर घण्णा प्रवाहुथी
पडवाथी इन उत्पन्न थाय छे, तेथी श्रीयमुनालुनुं स्वरूप वाटतविक
रीते श्याम हावा छतां प्रवाह स्वेतरूप हर्षन आपे छे. वणी उच्चा
पर्वतीमां नीचा उच्चा लागेमां थधने गमन करतां हावाथी उपर
चढ़वुं अनेनिवृत्तरवुं चेवा एविदायथी गमन छे तेथी अत्यंत शोले छे
हवे उच्चा नीचा प्रदेशोमां गमननी शोभा वर्णन करे छे.

मूलम्-सधोषगतिदंतुरासमधिरूढदोलोत्तमा

मुकुंदरातिवर्द्धिनी जयति पद्मबंधोः सुता ॥२॥

सान्वयपदार्थः—सधोषगतिदंतुरा शण्डसङ्कुत यातवाथी विविध
तरेइना विकारवाणां (अनें) असमधिरूढदोलोत्तमा उत्तम पालभी
ज्ञेणु कारी रीते आरोहणु नहि करेती हाय नहिं शुं ? ऐवां
मुकुंदरातिवर्द्धिनी भुक्तिने आपनारा (लगवान्)मां प्रीतिने वधारनारां
पद्मबंधोः कमलना अंधु (सूर्य)नां सुता पुत्री (श्रीयमुनालु)
जयति ज्यने पामे छे.

शण्डार्थः—शण्डसङ्कुत यातवाथी विविध प्रकारना विद्यावाणां
उत्तम पालभी ज्ञेणु कारी रीते नहि आरोहणु करेती हाय शुं ?
तेम हेमातां ऐवां अने भुक्ति आपनारा जे श्रीक्षगवान् तेमां
प्रीतिने वधारनारां अने कमलना अंधु जे सूर्य तेनां पुत्री श्रीयमु-
नालु ज्यने पामे छे.

टीका—सशण्ड (शण्डसङ्कुत) जे गति तेथी विकारयुक्त
अथवा प्रज्जननाहिकुनी गतिथी विविध विकारयुक्त, एवे विशेषणुमां
घाष शण्ड द्विअर्थी छे, संस्कृतमां शण्ड थेवो ऐनुं नाम पण्ड
घाष छे, अने ज्यां बज हाय त्यां ते भू (पृथ्वी) लागने पण्ड
घाष कडेवाय छे; ए अंने अर्थ अताऽया अने दंतुर शण्डने
अर्थ उच्चा नीचा एवो थाय छे, तो पण्ड श्रीगुसांडिल्ये परभक्त

જ્યેષ્ઠેવડવિના કાવ્યનું પ્રમાણું લઈને વિકારસુકૃત અવો અર્થ કરો। એ સમાન જૂભિમાં જ્યાં પધારે છે ત્યાં પવનથી ધર્ણી લહેરો હેણાય છે, ત્યાં એવી ઉત્પ્રેક્ષા થાય છે કે જીણે શ્રીયમુનાજી પાલ-ખીમાં બેશીને પધારે છે કે શું? આંહી શ્રીયમુનાજીનું આધિક્ષોત્તિક સ્વરૂપ જલાત્મક છે એજ પાલખીને સ્થાને અને તેમાં બેશીને આધિક્ષેવિક શ્રીયમુનાજી પધારે છે. અર્થાત् એમ જણાય છે કે શ્રીયમુનાજી પાલખીમાં નથી જિરાજતાં તે! પણ જીણે જિરાજે છે. એવી શોલા શ્રીયમુનાજીની છે. તે પછી પૂર્ણી ઉપર પધારીને મુકુંહ કે મુક્તિ આપનાર શ્રીભગવાન् તેમનામાં પ્રીતિ વધારવાવાળાં શ્રીયમુનાજી ઉત્કૃષ્ટતાથી વર્તે છે. આ શ્લોકથી એમ સિદ્ધ થયું કે શ્રીયમુનાજી સૂર્યમંડલથી પ્રગટ થઈને કલિંદ પર્વતના શિખરાદ્ધિક ખાગમાં આવીને પૂર્ણીમાં પધારીને પ્રભુના ચરણુંમદદમાં પ્રીતિ રધારવાવાળાં થયાં. એ પાંચ વિશેષયુથી બીજું એથર્ય “શ્રીભગવાન્માં ભક્તિવર્જીકરણું” એ સ્પષ્ટ સિદ્ધ થયું. એજ પ્રકાર શ્રીમહાયાર્થ જરણોએ શ્રીયમુનાજીનું આડ પ્રકારનું એથર્ય કર્મથી જનાન્યું છે.

હુવે ત્રીજ શ્લોકમાં પૂર્ણીમાં પધારીને ભગવાન્માં પ્રીતિ કરાવાઝી શ્રીયમુનાજીનું એથર્ય શ્રીમહાપ્રભુજી કરે છે.

મૂલમ—મુવં ભુવનપાવનીમચિગતામનેકસ્તરનૈઃ

ત્રિયામિરિવ સેવિતાં શુક્રમયૂરહંસાદિમિઃ

તરઙ્ગમુજકઙ્કાપ્રકટમુક્કિકાવાદુકા ।

નિતમ્બતટસુન્દરોં નમતકૃષ્ણગતુર્યચિયામ્ ॥૬॥

સાંન્યપદાર્થઃ—ભુવનપાવનીમ (સર્વ) લોકને પવિત્ર કરનારાં મુવં પૂર્ણી ઉપર આવગતામૂં પધારેલાં પિયામિઃ પ્રિય સાખીએઓએજ હવ નેમ અનેકસ્તરનૈઃ અનેક જેના શણ્ણો છે (અવા) શુક્રમયૂરહંસાદિમિઃ પ્રોપટ, મોર, અને હંસ વગેરે (પક્ષીએ) એ સેવિતામૂં સેવા કરાયેલાં (અને) કરંગમુજકઙ્કાપ્રકટમુક્કિકાવાદુકા નિતમ્બતટમું રોમ્ તરંગ ને

લેહરો તે રૂપી બુજ્જમાં (રહેલાં) કંકણને વિષે ખુલ્લી રીતે દેખાતા મુક્તાકૃગ્રંથી જે વાલુકા (રેતી) તે વડે ચુક્ત એવા અસ્તિપ્રાતાભાગે કરીને સુંદર એવાં કૃષ્ણતુર્યપ્રિયામ् કૃષ્ણનાં ચોથાં પ્રિયા (શ્રીયમુનાલુ) ને નમત નમન કરે.

શબ્દાર્થ—સુવ્ય લોકને પવિત્ર કરનારાં અને તેઠલાજ માટે પૃથ્વી ઉપર પધારેલાં અને પ્રિય સાખીઓએંજ કિંવા હાસીઓએંજ નેમ સેવા કરાય તેમ અનેક શબ્દવાલાં પોપટ, મોર અને હંસ વિંગેરે પક્ષીઓએ સેવા કરેલાં, અને પોતાની લેહરો રૂપી શ્રીહસ્ત વિષે રહેલાં કંકણમાં ખુલ્લી રીતે દેખાતાં મુક્તાકૃગ્રંથ રૂપી વેળુ વડે ચુક્ત એવા કટિપશ્ચાત્માગથી સુંદર એવાં શ્રીકૃષ્ણ પ્રમુનાં ચોથાં પ્રિયા શ્રીયમુનાલુને નમન કરે.

ગ્રીકા—શ્રીમહાપ્રભુલુ પોતાના શિષ્ય પ્રતિ “શ્રીયમુનાલુને નમન કરો ” એવો ઉપહેશ કરે છે. તે શ્રીયમુનાલુ કેવાં છે કે સર્વે લોકને પવિત્ર કરવાનાળાં. શ્રીયમુનાલુને પૃથ્વી ઉપર પધારવાનું એજ પ્રયોજન છે, યમ પ્રત્યે શ્રીયમુનાલુનું વાક્ય છે કે સાત સમુદ્ર, સાત દ્વીપ, ચાર આરા, એંઝેનું લેદન કરીને પવિત્ર કરતાં છતાં સ્વાશ્રિતના પાપને! નાશ કરવા માટે રમતી રમતી હું પૃથ્વીમાં ઉત્ત્યાયન પ્રાપ્તે ગમન કરીય. બીજાં એ વિશેખણું વડે સ્નેહ ઘોતન થાય છે, જે લગવાનને વિષે સ્નેહ ન થાય તો મૂલ ધારને ત્યાગ કરી ભુવન પાવનરૂપ ડાર્યને માટે પૃથ્વીમાં ન આવે; અને આવીને પણ લીલાને માટે સામથી સહિત ન થાય; અને તેથી અતિશાય પણ ન થાય. તે હેતુ માટે લગવાનને વિષે સ્નેહનું સૂચન થાય છે. વળી જુદા જુદા શાખ કરવાવાળા જે પોપટ, મોર, હંસ, વિંગેરે પક્ષીઓથી સેવા કરાયેલ છે તે નાણે પોતાની સાખીઓથી સેવાયેલ હાય તેમ. આ વિશેખણુથી ભગવદ્ધિયક રસનો અત્યંત ભાવ સૂચન કર્યો. એ પ્રમાણે તીરની શોભા કહી, તેવીજ રીતે આપ પણ શોભાયમાન છે તે કેવી રીતે કે, જ્યારે પોતાની લહેરો કિનારે આવી ફેલાઈ જાય છે ત્યારે તીરના વેળુ મેતી સમાન શોભા આપે

છે. કૃપાતુર્યમિયામ એ વાક્યનું વિવૃત્તિમાં શ્રીયુસાંગ્રહિતુચે વ્યાખ્યાન કર્યું નથી, કેમકે નમનનું તાત્પર્ય પૂર્વે સ્કુટ છે. શ્રીહરિરાયજી વૈષ્ણવમાં કંઈ છે કે શ્રીલગ્નવતમાં કાલિદી અને યમુનાળુને લેદ ભૂતમાં બતાવ્યો છે, અને તેનો આધિક્લોતિક અને આધિહેવિક લાલ શ્રીયુદ્ધાધિનીળમાં નિરાસ કર્યો છે. યમુના માહાત્મ્યમાં રુક્ષિમણી આદી વણુર્થી સાપેક્ષિત ચાથાં શ્રીયમુનાળુ હોઈ શકતાં નથી પરંતુ નણું સણુર્થી સાપેક્ષિતયુણુત્તાત્ત્રપે ચાથાં વણું ન કરાયેલ છે.

હવે આ ચાથા લોકમાં શ્રીમહાપ્રભુજી શ્રીયમુનાળુમાં જગતાનના જમાન ધર્મ છે તે ધર્મનું સૂચન કરે છે.

મૂલમૂ—અનંતગુણભૂषિતે શિવવિરિંચિદેવસ્તુતે ।

ઘનાઘનનિભે સદા ધ્રુવપરાશરાભીષ્ટદે ॥

વિશુદ્ધમયુરાતટે સકલગોપગોપીવૃત્ત ।

કૃપાજલવિસંશ્રિતે મમ મનઃસુખં ભાવય ॥૪॥

સાન્વયપદાર્થ:—અનંતગુણભૂષિતે અનંતગુણોચે કરીને શોભાયમાન (અને) શિવવિચિદેવસ્તુતે મહાદેવ, પ્રક્રિયા અનેદેવતાઓએ સ્તુતિ કરેલાં સદા નિરંતર ઘનાઘનનિભ ભોટા મેઘના સરખી કાંતિવાળાં (તેમજ) ધ્રુવપરાશરાભીષ્ટદે ધ્રુવ અને પરાશરને ઈચ્છિત ઝલ હેવાવાલાં વિશુદ્ધમયુરાતટે વિશેષે કરીને શુદ્ધ એવાં મથુરાળુ જેના કિનારા વિષે છે (અને) સકલગોપગોપીવૃત્તે અથાં ગોપ અને શ્રીગોપીજનોએ કરીને વીઠાએલાં (તેમજ) કૃપાજલધિ સંશ્રિતે દ્વારા સમુદ્રત્પા (શ્રીપ્રભુ)નો સારી રીતે આગ્રહ કરીને રહેલાં એવાં (હે શ્રીયમુનાળુ) મમ ભારા મન સુખ ભનના સુખને ભાવય વિચારો.

શાખદાર્થ:—અનંત ગુણોચે કરીને શોભાયમાન અને મહાદેવ, પ્રક્રિયા અને દેવતાઓએ સ્તુતાં કરેલાં, નિરંતર ભોટા મેઘના સરખાં કાંતિવાળાં તેમજ ધ્રુવ અને પરાશરને ઈચ્છિત ઝલ હેવાવાળાં અને વિશેષે કરીને શુદ્ધ એવાં મથુરાળુ જેના કિનારા વિષે છે, અર્વા

જોપ અને જોપીજનોંચ કરીને વીટાયેલાં અને હયાના સાગર સહાનંદ શ્રીપ્રભુનો સારી રીતં આશ્રય કરીને રહેલાં એવાં હે શ્રીયમુનાલુ ! તમેજ મારા મનને કેમ સુખ થાય તેમ વિચારો.

વિવેચનઃ—ભગવાન ષડગુણ વિશિષ્ટ છે તેવાંજ શ્રીયમુનાલુ પણ છે. એ ઐક્ષર્યાદિક ષડગુણ એ પ્રકારના સમજવા એક પુષ્ટિમાર્ગીય અને ધીજા મર્યાદામાર્ગીય. ત્યાં શાંકા થાય કે પુષ્ટિમાર્ગીય ગુણ કયા કયા અને કયાં લગેલા છે ? ત્યાં કહે છે કે ષડગુણ શ્રીલગવતદશમસ્કરણના ક્ષલ પ્રકરણમાં અને વણુગીતમાં ઘન્યાસ્તિત એ શ્રોકથી છ શ્રોકે કરીને નિર્દિષ્ટ છે, તે ગુણ અહિં છ વિશેષખુથી શ્રીયમુનાલુમાં નિર્દિષ્ટ કરે છે, એ શ્રોકમાં સંસ્કૃત રીતિથી જેટલાં વિશેષખુ આચાયાં છ તે બનેનાં છે, એટલે શ્રીયમુનાલુનાં તથા શ્રીપ્રભુનાં છે, પરંતુ પ્રભુપક્ષમાં સર્વ વિશેષખુ સસ્તમી વિલક્તયાંત છે, અને શ્રીયમુનાલુના પદમાં એ સર્વ વિશેષખુ સંબોધનથી છે. કંબ અનંત અસરંખ્ય ગુણ કે ઐક્ષર્યાદિક તેણુ કરીને ભૂષિત શ્રીલગવાન છ, તેમજ શ્રીયમુનાલુ પણ છે. સર્વ સહગુણને સાહિત્ય રહ્યું તેશ્વરી ગુણની સર્વ સ્થાને પૂજન થાય છે તેથી લગવાન પૂજય છે અને તેમના ગુણોં પણ પૂજય છે, એમ જુદે તો ગુણ છે તે પૂજલોહ બતાવે છે કેમકે થોડા વિદ્ધાન કરતાં ધણું વિદ્ધાનને દોકમાં વધારે માને છે, તેમજ પ્રધાન કરતાં રાજની વિશેષ મહત્ત્વ છે, તેવી રીતે ગુણ પ્રમાણે ન્યૂનાધિક માન્યતા છે. તેમ ધીજ દેવ કરતાં પ્રભુમાં અધિક ગુણ હોવાથી તે સર્વ માન્ય છે, તેવાંજ ગુણ શ્રીયમુનાલુમાં છે; તેશ્વરી શ્રીયમુનાલુ માન્ય છે. એ વિશેષખુથી ઐક્ષર્ય નિર્દિષ્ટ કર્યું. હુંવે વળી શ્રીયમુનાલુ કેવાં છે કે, શિવજી, પ્રભ્યાલુ અને ધીજ સર્વ દેવોઓ નેની સ્તુતિ કરી છે. એવા શ્રીલગવાન છે, તેવાંજ શ્રીયમુનાલુ પણ છે. એ વિશેષખુથી વિર્યનું નિર્દિષ્ટ કર્યું. વળી વરસતા ધારા મેધના જેવી નેની ડાનિત છે એવા શ્રીલગવાન છે અને શ્રીયમુનાલુ પણ તેવાં છે એ વિશેષખુથી સ્વરૂપનું સૌંદર્ય પણ બતાવ્યું. નેમાં સર્વાસંક્રિતમૂલક યશનું નિર્દિષ્ટ કર્યું. વળી મુવળુ અને પરાશર ઋષિ એ બનેને મનોલોલખિત ક્ષલ આપનાર શ્રીલગવાન છે તેવાંજ શ્રીયમુનાલુ પણ છે. અહિં

શાંકા થાય કે પ્રવાદિકને વરદાન તો શ્રીભગવાને આપ્યું છે, તો શ્રીયમુનાલુ વર આપવાવાળાં કેવી રીતે ? તેના ખુલાસામાં શ્રીયુસાંધળુ લખે છે કે શ્રીયમુનાલુના તીર ઉપરજ પ્રલુ પ્રસંગ થઈને પ્રકટ થયા, તેથી શ્રીયમુનાલુએ પણ તેમના મનોરથ પૂર્ણ કર્યા છે એ અલિપ્રાયથી શ્રીમહાપ્રલુલાએ પણ તેવું વિશેષણ આપ્યું છે. આ વિશેષણનું તાત્પર્ય એવું છે કે પોતાને શરણ આવેલા સેવકને પોતાના એચ્છીર્ય જ્ઞાનદ્વાર્પ મનોરથ પૂર્તિ કરવાથી બીજાઓએ પણ એનો અનુભવ કર્યો, તેથી શ્રીનું નિર્દ્દેશ થયું. વળી સર્વ દોષ રહુંત અર્થાતું જેમાં ભૂભ્યાહિ દોષ નથી એવા મથુરાલુ અર્થાતું વિશુર્દ્ધ મથુરાલુ જેન્ય તરમાં છે, એડિ મથુરાલુ જેના સજીવાનમાંજ છે; એ વિશેષણ માટે શ્રીહરિરાધળ લખે છે કે નિરંતર પ્રલુના સાનિધ્યભાવથી ભક્તિ આપવાવાળાં છે તેથી જ્ઞાનનું સૂચન કર્યું. વળી સક્ષત ગોપ અને ગોપીજન એ સધગાથી આવૃત (વીઠાએલાં) તો ભગવાનના જરૂરાક્ષમાં પણ તેમના સંબંધની આશા રાપવાવાળાં ને લક્ષ્ય કરે તે લક્ષ્ય ભગવાનનો સંબંધ શ્રીયમુનાલુમાં છે એવા નિશ્ચયથી શ્રીયમુનાલુની પાસે આવીને કપટ વિના શ્રીયમુનાલુનું સેવન કરે છે; અને સર્વદા ભગવાનમાં પ્રેમ રાખે છે, પરંતુ જ્યારે લક્ષ્યને અલિમાનાદિક દોષ ઉત્પન્ન થાયું છે ત્યારે તેનું નિવારણ કરે છે; અને ભગવાનના ચરણુારંદિનમાં સર્વસ્ત્ર નિવેદનથી દદ ભાવ ઉત્પન્ન થાય છે. આ વિશેષણથી વૈરાગ્યનું નિર્દ્દેશ કર્યું. હવે કૃપાને માટે સાગરે આશ્રી કર્યો છે જેનો એવા ભગવાન અર્થાતું અપાર કૃપાયુક્ત ભગવાન છે, તેમજ શ્રી યમુનાલુ કૃપાના સાગર શ્રીભગવાન તેમને મળે છે. આ વિશેષ બોધક પદ છે. પ્રથમ ષડગુણનું નિર્દ્દેશ છ વિશેષણથી થયું અને આ સસમ પહ વિશેષ બોધક છે; તેનો હેતુ એ કે ભગવાનમાં કૃપા સહા સર્વદા આવિભૂત છે, તેથી સ્વર્ણપવાચકજ છે કૃપા ગુણું બીજા ગુણો જેવો નથી, કેમકે બીજા ધર્મો જે કે નિત્ય છે તોપણ ને જે ધર્મ ને લીલામાં ઉપયોગી હોય તે લીલામાં પ્રકટ કરે છે એમ કૃપાના વિષયમાં નથી. કૃપા તો સહા સર્વદા આવિભૂત છે, આ વિશેષખનું તાત્પર્ય એ છે કે જેને શ્રીયમુનાલુનો સંબંધ હોય

તેને ભગવાનનો પણ સંખ્યા થાય છે. હવે શ્લોકના છેવટમાં માર્થના કરે છે કે હે શ્રીયમુને ! મારા મનતું ને કંઈ ભગવતપ્રામણ્ય સુખ છે તેને ઉત્પાહક કરો, અથેવા હે શ્રીયમુને ! ને રીતે મારું મન વિના અમે અલિપ્ટ સુખને પોહોચે તેમ કરો.

હવે ઉપરના ગુણને શ્રીહરિરાયજીએ કંઈક કિન્ન કુમથી બતાવ્યા છે તે નીચે પ્રમાણે.

૧ પ્રથમ વિશેષણુથી અસંખ્ય અને અનાહિવાચક અનંત શખ્દથી ગુણનો ધર્મ બતાવ્યો તેથી અતિ સામર્થ્યદ્વારા ઐશ્વર્ય સૂચન કર્યું.

૨ બીજા વિશેષણુથી હેવનેતૃત્વ વિર્ય સૂચન કર્યું.

૩ ઘનાવનનિઃસ્વા એ ધર્મી છે વિશેષણ નથી.

૪ ચોથા વિશેષણુથી મૃત્વાદિને અલિપ્ટ ઇલ આપવાથી થશ સૂચન કર્યો.

૫ પાંચમા વિશેષણુથી ભગવાનતું દાસસાનિધ્યભાવ છે તેથી જ્ઞાન ઉત્પન્ન થાય લ્યારે વિશુદ્ધપણું થાય તો શ્રીમથુરાળનું વિશુદ્ધ વિશેષણ આપવાથી જ્ઞાનતું સૂચન કર્યું.

૬ છુટું વિશેષણુથી શ્રોતું સૂચન કર્યું તેનું કારણ એ છે કે ગોપગોપીજન વેણીન ભિરાને છે તેથી શોભા ધારી દેખાય છે.

૭ સાતમા વિશેષણુથી વૈરાગ્યનું નિર્દ્દિષ્ટ કર્યું એનો અલિપ્રાય એવો છે કે જ્ઞારે વૈરાગ્ય થાય લ્યારે દ્વારા ઉત્પન્ન થતાથી કૃપાળુતા હોય તે વિષે કહ્યું છે કે “ નાહમાત્માનમાશાસે મદ્દકૈ: સાધુમીર્વિના ” હું આ માની પણ સાધુભક્તવિના વિશેષ દર્શિં રાખતો નથી. એમાં એ હેતુ છે કે પ્રભુ પણ ભક્તજન વિના આત્મામાં વૈરાગ્ય દેખાડે છે. તો તેમનો સંશ્ય કરનારાં શ્રીયમુનાળું પણ તેવાંજ સમજવાં.

આ શ્લોકમાં શ્રીભગવાનના ભરોબર ધર્મ શ્રીયમુનાળમાં છે તેથી વિનાશમ પ્રભુનો સંખ્યા કરાવી હે છે તેનું નિર્દ્દિષ્ટ કરી ચોથા ઐશ્વર્યનું નિર્દ્દિષ્ટ કર્યું છે.

એ રીતે ચાર શ્લોકથી શ્રીયમુનાળનું સ્વરૂપ અને ગુણ કહ્યા, અર્થાતું ઉત્કર્ષ વર્ણન કરીને સ્તુતિ કરી.

**मूलम्—यथा चरणपद्मजा मुररिपोः प्रियंभावुका
समागमनतोभवत्सकलसिद्धिदा सेवताम् ॥
तथा सद्वशतामियात्कमलजा सप्तनीवय-
छरिप्रियकर्लिङ्दया मनसि मे सदा स्थीयताम् ॥५॥**

सान्वयपदार्थः—यथा जेनी साथे समागमनतः समागम थवाथी चरणपद्मजा गंगालु मुररिपोः मुर नामे हैखना शत्रु (श्रीलग्वान्) ना प्रियंभावुका प्रियने करनारां (अने) सेवताम् (पातानी) सेवा करनाराओने सकलसिद्धिदा भवं सिद्धि आपनारां अभवत् थयां तथा ते (श्री यमुनालु) नी साथे सद्वशता समान (अदेवरी) पणुने सप्तनी समान सौभाग्यवाणां (शेषक्य) एवां कमलजा लक्ष्मी इव नंभ (तेभ) इयात् (डेणु) पामे ? यत् (यदि) जे (कहाचित्) इयात् समानपणुने पामे ते। कमलजा लक्ष्मीलु इयात् पामे (एवां) हरिप्रिय कर्लिङ्दया लरिना प्रिय (जे लक्ष्मी ते) ना क्षेत्रने अंडन करनारा (श्रीयमुनालु) ए म (मम) भारा मनसि भनभां सदा सदायकणे स्थीयताम् सिद्धं रहे। (जिराजे).

शब्दार्थः—जेनी साथे भणवाथी गंगालु पणु लग्वानला प्रियने (प्रातिने) करनारां अने पातानी सेवना करनारा गुवाँन सवं सिद्धियो आपनारां थयां ते श्रीयमुनालुनी साथे अदेवरी। सरभां सौभाग्यवाणां लक्ष्मीलुनी पेठे बीजुं डेणु करी शके। जे कहाचित् श्रीयमुनालुनी अदेवरी करे ते। लक्ष्मीलु करी शके। आवां श्रीयमुनालु भारा भनभां नरंतर अराजे।

विवेचनः—उपर जे श्रीयमुनालुने उत्कृष्ट वर्णन कर्मा तं योज्यज्ञ छे अने तेथी श्रीमहार्यार्थ आप भारा हृदयभां सदा भिराजे एवी प्रार्थना करे छे। अने श्रीयमुनालुनुं स्वदृप वर्णन करे छे के आप डेवां छो के श्रीप्रभुना चरणुक्ती उत्पन्न थयां एवां श्रीगंगालु आपना भिलापथी श्रीप्रभुने प्रिय अने पोताना सेवकं सकल साक्ष आपनारां थयां। आ स्थणे श्रीमहाप्रभुलुचे श्रीगंगालु नहि कडेतां चरणुपद्मजे ए नाम कहुं तेनु तात्पर्य ए छे के

શ્રીમહપ્રબુના ચરણુકમલ છે તે નિર્દેષ પૂર્વગુણ છે, અર્થાત् ભક્તિ રૂપજ છે; તેથી ઉત્પજ્ઞ થયેલાં શ્રીગંગાળુ પણ નિર્દેષપૂર્વગુણ થયાં; કેમકે જે ગુણ ડારણામાં હોય તે કાર્યમાં આવે તે વાત લોકાનુભવ સંદૃષ્ટ છે; નંમકે લાલ તંતુથી બનેલું કપડું લાલ થાય, અને પીળા તંતુથી બનેલું પીળું થાય, એ ઉદ્ઘાસ્તરણથી જે જે ગુણ ભગવત્ ચરણારવિંમાં છે તે શ્રીગંગાળમાં આવે; તથાપિ શ્રીયમુનાળુના સંગમ પહેલાં પ્રબુને પ્રિય નહોતાં, કારણ કે ચરણપ્રક્ષાલનરૂપી જલમય લૌટિક હતાં તે પછી ગંગાળને અન્ય સંગતિ રહી ત્યાર પછી શ્રીયમુનાળુની સંગતિ થઈ. તેથી કહ્યું છે કે—

“ સા રાજનદર્શનાદેવ બ્રહ્મહત્યાડપહારિણી ” (સે માનન! આ [ગંગા] હશનિશીન પ્રક્ષાલત્યાખ્ય પાપને નાશ કરે છે) એ વાક્યથી તથા વદમાં પ્રયાગનું વણું કર્યું છે તે, અર્થાત् શ્રીગંગાળ તથા શ્રીયમુનાળુના સંગમ થાય છે તેનું વણું છે; તે શ્રુતિને! અર્થ જયાં ઐત અને શ્યામ નહીં મળે છે (ત્યાં) કે મનુષ્ય સ્નાન કરે છે તે તે સ્વર્ગને પામે છે, અને કે વિદ્ધાન ધીર પુરુષ પોતાનું શરીર ત્યાં છાડે છે તે મોક્ષને પામે છે. ત્યાં ઐત ગંગાળ અને શ્યામ શ્રીયમુનાળુ એ અનેના સંગમનું સ્થાન પ્રયાગસ્કૃટ પ્રતીત થાય છે.

હવે એમ સિદ્ધ થયું કે શ્રીયમુનાળુના સંબંધથીજ ગંગાળ અધિક માહાત્મ્યવાન થયાં છે. તો શ્રીયમુનાળુની બરાધરી બીજું કાણું કરી શકે અર્થાત્ કેદી નહિં. છતાં કડે છે કે કદાચિત્ કેમલન કે લક્ષ્મી તે સમાનતા કરે તો કરી શકે; તેમાં હેતુ એ છે કે શ્રીલક્ષ્મીજ પોતાનાં સપ્તની છે, કદાચિત્ સપ્તની સમાનતા કરે તો થાય છે, પરંતુ તોપણ શ્રીયમુનાળુની બરાધરી કરી શકે તેમ નથી; કેમકે જે હરિલક્ષ્મા છે તેના દોષને શ્રીયમુનાળુ ફૂર કરનાર છે શ્રીલક્ષ્મીજ નથી. અહીં લક્ષ્મીળુનું નામ કેમલન કહ્યું તેનું પ્રમાણ વિષ્ણુપુરાણમાં લક્ષ્મીળુની કથામાં “ પુનશ્ચપદ્માદ્બૂતા આ-
દિત્યોઽમુદ્યર્દા હરિઃ જયારે પ્રબુ સૂર્યઉપે થયા ત્યારે શ્રીલક્ષ્મીજ
કભાગથી પ્રકૃત થયા ” અને ઈદ્રકૃત સ્તુતિમાં પણ “ નમસ્તે સર્વમૂ-
તાનાં જનર્નામબ્જસંમવાસ ” એમ કહેલું છે. હવે શ્રીયમુનાળુ

प्रभुने वहु वहालां छे तेना हेतु ए छे के ते अक्षतना होष निवारणु करे छे. ए वात हरिमियकलिंदिया ए विशेषणुथी सिद्ध थाय छे. उमडे हरिने प्रियं ने अक्षतना तेना कलि एट्टेहे होष तेना हा एट्टेहे अंडन करनार, ए विशेषणुविशिष्ट श्रीयमुनालुने हृदयमां पधारवानी प्रार्थना करी तेना हेतु ए छे के जे श्रीयमुनालु हृदयमां भिरजे तो हुं प्रभुने प्रिय थाउ आ श्वेतमां पांचमुं अर्क्षर्य अक्षतना होष निवारणु करवापाणुं सिद्ध थयुं. (५)

हे पूर्वोक्त शुण्याथी एम भिद्ध थयुं के आप समान वीजुं कांध नथी एट्टेहे एवां सामर्थ्य विशिष्ट श्रीयमुनालुने नमन विना वीजु कांध करी शकातुं नथी, अने ते नमन पाणु प्रभु कृपा हेय त्यारेन थाय. श्रीप्रभुनी कृपा हेय ताज श्रीयमुनालु उपर शङ्खा थाय भाटे आगणना श्वेतमां नमनपूर्वक श्रीयमुनालुनुं चरित्र वर्णन करे छे.

मूलम्—नमोस्तु यमुने सदा तय चरित्रसत्यद्भुतं

न जातु यमयातना भवति ते पय पानतः ॥

यमोपि भागिनीसुतान्कथमु हंति दुष्टानापि

प्रियो भवति सेवनात्व हर्यथा गोपिकाः ॥६॥

सान्वयपदार्थः—यमुने हे यमुनालु सदा निरंतर नमः (तमने) नमस्कार अस्तु हे (अने) तव तमाइ चरित्रम् चरित्र अत्यदूसूर्वं अतिशय अह्भूत छे (करणु के) तव तमाइ पयःपानतः पय (जब) पान करवाथीज यमयातना यम (राजा) संबंधी हुःअ जातु क्यारे पाणु न नथी भवति थतुं (अने) यमः यम (राजा) अपि पाणु दुष्टन् दुष्ट [भराभ एवा] अपि पाणु भगिनी सुतान् वेनन्म छक्षरांच्चाने उ अहे (अरे) कथं उम हंति भारे छे ? (भारे नहि) तव तमारी सेवनात् सेवना [सेवा] करवाथी यथा ज्ञेम गोपिकाः गोपीज्ञा (तेम) हरेः हरि (हुःअ करनार प्रभु) ने प्रियः वहावै प्रवति थाय छे.

શાખાથી—હે યમુનાજી ! નરંતર તમને નમસ્કાર છો ! અને નમાંડું ચરિત્ર અતિશાય અહલુત છે, કારણ કે તમાં જલપાન કરવાથીજ યમરાજ સંબંધી હુઃખ ક્યારે પણ થતું નથી અને યમરાજ પણ હુંટ એવાં પણ બેનનાં છોકરાંઓને કેમ મારે ? (મારે નહિ) તમારી સેવા કરવાથી કેમ ગોપીઓ હુરિને પ્રિય થય તેમજ જીવ પણ તમારી સેવા કરવાથી હુરિને પ્રિય થાય છે.

વિવેચનઃ—શ્રીયમુનાજીને નમનપૂર્વક કહે છે કે તમાં ચરિત્ર અત્યંત અહલુત છે, અહલુત એટલે દોષાંક રીતથી વિલક્ષણ એટલે ને પહાર્થ કેનું સાધન નથી તંતે તેનું સાધન કરી દેવું એ વિલક્ષણતા તેજ અહલુતપણું, કેમ આપતુ ચરિત્ર અહલુત છે તેમજ શ્રીપ્રભુયનું ચરિત્ર પણ અહલુત છે, તે નિષંધના પ્રારંભમાં શ્રીમહાયાર્થચરણ આજા કરે છે કે “કૃપણાયાડ્રભુતકર્મण” હુવે અસાધનને સાધન કરવામાં ઉદ્ઘાસ્તણ આપે છે કે જેમ કામાદિક પહાર્થ ભાક્તમાં પ્રતિબંધક અર્થાતુ અસાધન છે, પરંતુ તેજ કામાદિને પ્રભુ પરત્વે લગાડે તો પ્રભુ તેને પ્રમેયબળથી ભક્તિમાં સાધન કરી હે છે. જેમકે શ્રીગોપીજનને ભક્તિ સિદ્ધ થઈ, તેમજ શ્રીયમુનાજી પણ અસાધનને સાધન કરે છે, જેમકે જળપાનથી યમયાતનાનો અભાવ, તે કહે છે કે, હે શ્રીયમુનાજી ! તમારા જળપાનથી ક્યારે પણ યમરાજ તરફનું હુઃખ તમારા ભક્તને નહિ થાય એમાં અહલુતાં હું એ કે તૃપ્તાના હેતુથી જળપાન કરનાર ભક્તને પણ યમરાજની તરફનું હુઃખ ભરે છે. પદ્ય શાશ્વતના એ અર્થ થાય છે એડ જલ અને બીજે દૂધ. તેથી બીજે અર્થ પણ એવો છે કે આપના દૂધના પાનથી યમયાતના થતી નથી. સાધારણ રીતે માતાના પદ્યપાનથી યમયાતના દૂર થતી નથી, પરંતુ આપના પદ્યપાનથી તેમાં દૂર થાય છે. (અહિ શ્રીયમુનાજીનું દૂધ પાન કર્યું તેનો ભાવાર્થ એવો છે કે શ્રીયમુનાજીમાં માતૃભાવ રાખી જળપાન કર્યું તેજ દૂધપાન કર્યા બરાબર છે) ત્યાં શાક થાય કે તેમાં હેતુ શુ ? ત્યાં કહે છે કે યમરાજ પોતાની બેનના પુત્ર હુંટ હોલ તે

પણ તેને હુઃઅ કેમ આપે ? અર્થात् ન જ આપે. કેમકે બેનના. પુત્ર ભાણેજ થયા, તો ભાણેજ તો મૂળય છે, તેથી તેને હુઃઅ નજ આપે. હવે શ્રીયમુનાલુ યમનાં બેન કેવી રીતે તે વિષે કહે છે કે યમ સૂર્યના પુત્ર છે, અને યમુનાલુ સૂર્યના મુત્રી છે, તેથી યમરાખનાં નાનાં બેન છે. હવે ઉપર કહ્યું કે યમયાતના થતી નથી તો તેમાં શું પ્રમાણ ? ત્યાં કહે છે કે યમુના માદાતમ્યમાં યમુનાલુ પ્રત્યે યમે કહ્યું છે કે—

યમુને કૃપયા પાપાનવર્ણં તારયિષ્યસિ ।

મયિ ત્વયા દ્વયા કાર્યા નિર્દ્યે નિગ્રહીતરિ ॥

હું યમુના ! આપ કૃપા કરીને પાપીઓનું તારણુ કરશા, તો મારા ઉપર પણ આપને દ્વયા કરવી ઉચ્ચિત છે. ઠારણ કે લોકના નિયમ કરવાવાળો હું નિર્હીય છું. ત્યાં શ્રીયમુનાલુએ ઉત્તર આપેલ છે કે—

એવમस्तु મદંમોભિઃ સ્નાત્વાત્વામાદરાન્તરાઃ ।

દશભિશ્વચતુર્ભિશ્ર તર્પયિષ્યતિ નામભિઃ ॥

તેન હિસા પરોડપિત્લં ધૃતકલો ભવિષ્યસિ ।

નિરાતંકા ભવિષ્યન્તિ ભવતોયેપિ પઃપિનઃ ॥

હવે એમ થશે કે મારાજલથી નહાઈને તમને આદર કરીને તમારા ચૈદનામથી તમારું તર્પણુ કરશો, તેથી તમે જો કે હિસાપર છો તોપણુ ધૃતકલ્ય (શુદ્ધક્રદ્ય) થશો, અને તે જીવ પાપી હશે તો પણ તમારાથી હુઃઅ નહિ પામે, એ વાક્યથી દોષઅય ફર કર્યો. હવે ઇલ બતાવે છે કે આપના સેવનથી પ્રલુને પ્રિય થવાય છે, તેમાં ઉદાહરણ કહે છે કે રીતે ગોપિકા આપના સેવનથી પ્રલુને પ્રિય થયાં, તેજ રીતે આ શ્લોકથી છું ઐધ્ય કે જે તમારા સેવનથી બજસકતાની પેઠું લગવાનને પ્રિય થવાપણું તે સિદ્ધ કર્યું. (૬)

હવે પૂર્વ શ્લોકમાં શ્રીયમુનાલુનું સ્વર્દ્ય સામર્થ્ય નિશ્ચયપણે જવાલીને હવેના શ્લોકમાં પ્રમુદ્યેતવમાં કે ઉપરોગી પદાર્થ છે તેનું અને જે અભિપ્રેત છે તેનું નિર્પણુ કરે છે.

**मूलम्-ममाऽस्तु तव सग्निधौ तनुनवत्वमेताचता
न दुर्लभतमा रतिमुररिपौ मुकुंदप्रिये ॥
अतोस्तु तव लालना सुरधुनी परं संगमा-
त्वैव भुवि कीर्तिता न तु कश्चापि पुष्टिस्थितैः॥७॥**

सान्वयपदार्थः—मुकुंदप्रिय भुजिति हेनारा लगवानने प्रिय (हे श्री-
थमुनालु) तव तमारी सग्निधौ सभीपमां मम भाइं तनुनवत्वं
शरीरनुं नवापश्यं (लीकामां उपयोगी देहनी नवीनता) अ तु याए
एताचता एटलाथी (शरीर परिवर्तन भावनी) मुररिगौ भुरहैत्यना
शनु (लगवान) मां रतिः प्रीति दुर्लभतमा अतिशयहुर्वाल न नथी
अतः ए कारण भाटे तव तमारी लालना (आ स्तुती इपी) लाड
अस्तु होय (अने) सुरधुनी श्रीगंगाल ते (पशु) परं डेवण तव
तमारा एव ज संगमात् संगमथी भुवि पृथ्वीमां कीर्तिता डीर्तन
करायेत छे (पशु तमारा शिवाय एकलाने वर्खाणेल नथी तेमां पशु)
पुष्टिस्थितैः पुष्टिभार्गमां रहेला (लुवो) ए तु तो कदा क्यारे अपि
पशु (तमारा शिवाय वर्खाणेलां) नथी.

शालदार्थः—भुजिति हेनारा लगवानने प्रिय हे श्रीयमुनालु !
तमारी सभीपमां भाइं शरीरनुं नवापश्यं (सिवेपयोगी देहनी नवीनता)
थाए। एटलाथीज भुरहैत्यना शनु लगवानमां प्रीति अतिशयहुर्वाल
नथी एटला भाटे तमारी आ स्तुति होय—(थाए) अने श्रीगंगाल
ते पशु डेवण तमाराज संभंधथी पृथ्वीमां डीर्तन करायेत छे, पशु
तमारा शिवाय एकलाने वर्खाणेल नथी तेमां पशु पुष्टिभार्गमां
रहेला लुवोए तो क्यारे पशु तगारा शिवाय वर्खाणेलां नथी.

विवेक्यनः—हेहुधारीओनो आवश्यक धर्म छे के श्रीयमुनालुना
तीर उपर वास्तु करीने तेमनु सेवन अने जलपान करतुं, ए व्यव-
हारथी श्रीयमुनालुनो संभंध शाय तो अक्षिप्ती पशु आधिक बे

મુદ્દિત તે પ્રાપુ થાય છે. તો તેને યમયાતના ન થાય તેમાં સહેલું નથી. શ્રીહરિશાયલુ કહે છે કે “આવદ્યકદૈહિકબર્મેપિ ત્વત્સંબંધે હૃદ્યબિકમકિપાસિર્યત્ર” વળી દેહ છે તે બીજા દેહનો આરંભ કરવાવાળો છે, અર્થાતું એક દેહથી બીજો દેહ થાય છે; અને દેહ વિના જીવ રહેતો નથી, તેથી એ દેહથી બીજા દેહનું આરંભપણું છે, તેમાં પ્રમાણું “પ્રજયા શરીરં સમારૂહા” પ્રજાએ કરીને શરીરનું અહૃદ્ય કરીને” એમ શ્રુતિ છે વળી એમ શાંકા થાય કે મુદ્દિતમાં તો દેહ છોડવોન જોઇએ કેમકે નન્યાં સુધી દેહ છે ત્યાં સુધી મુદ્દિત શેની? ત્યાં કહે છે કે મુદ્દિતમાં સેવોપયોગી દેહ રહે છે. વૈકુંઠાદિકમાં દેહાંતર પણ હાય છે. એ વાત શ્રીમહાચાર્યચરણે સેવાક્રત્વ વિવૃતિમાં લખી છે કે “સેવોપયોગી દેહો વैકુંઠાદિપુ” તેમાં પણ આણનું સાભાગ્યાન હાય અર્થાતું આપના સામીપ દેહાંતર પ્રાપ્તિ હાય ત્યારે તેને યમયાતના ન હાય તેનાં અન્યરીં શું? તમારા સંનિધાનમાં માર્દાં નવું શરીર થાય, અર્થાતું લીલોપયોગી નજી દેહની સંપાત્ત થાય, એ વાક્યથી પૂર્વ શરીરની નિવૃત્તિ બતાવી, તો તે વાત પણ આપના કરવાથીજ થશે એમ જણાવવા માટે અસુધી પદ્ધથી પ્રાર્થના છે. તેમાં તમારા સંનિધાનમાં શરીરની નિવૃત્તિ થાય અને તે પછી લીલોપયોગી નૂતન દેહની પ્રાપ્તિ થાય કેમકે બીજના સંનિધાનમાં દેહ ત્યાગથી ઉપર કહેલી નિર્દ્ધિ ન થાય. હવે તે પછી એટલે લીલોપયોગી દેહપ્રાપ્તિ પછી હે મુકુંદને પ્રિય એવાં શ્રી-યમુનાજુ મુરરિપુ શ્રીકૃષ્ણમાં પ્રીતિ હુલ્લાલ નથી. કારણું આપ મુકુંદ ને મુદ્દિત, આપવાવાળા છે તેનાં પ્રિયા છે. તેવીજ રીતે તે મુરરિપુ પ્રભુ પણ મુર ને જલહોષાત્મક હૈત્ય તેના શત્રુ છે, તેથી હોષ દૂર કરીને પછી અનુભહુ કરે છે. કેમકે લોમાસુરે ડન્યાઓને શાકી શાખી અને તેનો પ્રતિબંધક મુર હૈત્યને રાખ્યો હતો. ત્યારે પ્રભુએ પ્રતિબંધ દૂર કર્યો, અને તેમનો અનુભહુ કર્યો. તેવીજ રીતે આપના સંબંધથી પ્રભુ ભાગતના હોષ દૂર કરીને અનુભહુ કરે છે. એ વાત મુરરિપુ પદ્ધથી સૂચિત હરી. હવે ને હેતુથી શરીરની

નિવૃત્ત પર્યંત આપની સ્તુતિ થાય એવો પ્રાર્થના છે, તેણું તાત્પર્ય એ છે કે આપની કૃપા વિના સ્તુતિ પણ થઇ શકતી નથી. હવે સેવોપયોગી દેહની પ્રાપ્તિને અર્થે શ્રીયમુનાળુની પ્રાર્થના છે, તે બીજાની પ્રાર્થનાથી એ વાત સિદ્ધ થતી હોય તો શ્રીયમુનાળુની પ્રાર્થનાજ કેમ કરે? તેમજ બીજું કોઈ સેવોપયોગી દેહ સંપાદક નથી. પરંતુ શ્રીગંગાળુ તો છે, ત્યારે શ્રીગંગાળુની સ્તુતિ કેમ ન કરે? ત્યાં કહે છે કે યદ્યપિ ગંગાળુ ઇતસાધિકા છે એ વાત ખરી છે, પણ તે શ્રીયમુનાળુના સંગમથોજ, કેવળ શ્રીગંગાળુની સ્તુતિ દેખાતી નથી, શ્રુતિમાં સિતાસિતે હત્યાદિ વાક્યથી પણ શ્રીયમુનાળુ મિશ્રિતનીજ સ્તુતિ છે, કેવળ ગંગાળુની નથી. ત્યાં શાંકા થાય કે કોઈક પુરાણુમાં કેવલની પણ સ્તુતિ છે, તેનું કેમ? ત્યાં કહે છે કે ન તુ કદાપિ પુષ્ટિસ્થિતાઃ કહિ મર્યાદામાર્ગીય કેવળ ગંગાળુની સ્તુતિ કરે, પરંતુ પુષ્ટિમાર્ગીય તો કેવળ ગંગાળુની સ્તુતિ કરશે નહિઃ. મર્યાદા અને પુષ્ટિનું સ્વરૂપ શ્રીમહાગ્રાંભાયાર્થાચે પુષ્ટિપ્રવાહમર્યાદા લેદ નામના અંથમાં સ્કુટ બતાવેલું છે. મર્યાદામાર્ગીય કેવલની સ્તુતિ કરે છે તેનું કારણું એ છે કે તે શ્રીયમુનાળુનું યથાર્થ સ્વરૂપ જાણુતા નથી. અને પુષ્ટિમાર્ગીય આપનું સ્વરૂપ યથાર્થ જાણું છે; તેથી કેવલ શ્રીગંગાળુની સ્તુતિ કરતા નથી. આ બાખતમાં શ્રીપુરુષોત્તમલ એવો અલિપ્રાય જણાવે છે કે ગંગાળુની સ્તુતિ પૃથ્વી ઉપર થાય છે, પરંતુ તે આપની સંગતથી થાય છે, પુષ્ટિસ્થિત લોકે કંઈ પણ કેવલ શ્રીગંગાળુની સ્તુતિ કરી નથી, તેમાં કારણું એ છે કે ગંગાળુ જે કે સેવોપયોગી દેહસંપાદન કરે છે પણ જે અલિપ્ર અર્થાત જેવો મનોરથ છે, એવો સેવોપયોગી દેહસંપાદન કરતાં નથી. જે તેવો દેહસંપાદન કરતાં હોત તો તેમની સ્તુતિ કરત. આ લોકમાં પણ પૂર્વવત્ત સપ્તમ ઔદ્ધ્વર્ય સિદ્ધ કર્યું. ૭.

હવે આહમા લોકમાં શ્રીમહવલલભાગ્રાંભ શ્રીયમુનાળુની સ્તુતિ કરવામાં અસામથર્ય, સુચયબે છે.

**મૂલમ्-સ્તુતિं તવ કરોતિ કઃ કમલજાસપતિન પ્રિયે ॥
હરેર્યદનુસેવયા ભવતિ સૌર્યમાનોક્ષતઃ ॥
ઇયં તવ કથાધિકા સકલગોપિકાસંગમ-
સ્મરશ્રમજલાણુભિઃ સકલગાત્રજૈઃ સંગમઃ ॥૮॥**

સાન્વયપદાર્થ:-—કમલજાસપાલિ હે લક્ષ્મીલુના સમાન સૌભાગ્ય-વાળાં પ્રિયે હે પ્રિયે (હે શ્રીયમુનાલુ) તવ તમારી સ્તુતિ સ્તુતિને કઃ ડોણુ કરોતિ કરે છે (ડોઅ કરી શકતું નથી કારણુ કે) હરે: હરિ (હુઅ હરનાર લગવાન) સંબંધી વદનુસેવયા ને લક્ષ્મીલુની અનુસેવા તેણે કરીને આમોક્ષત મોક્ષપર્યેત સૌર્ય સુખ ભવતિ થાય છે (અને) તવ તમારી ઇયં આ કથા (માહાત્મ્ય) કથા અધિકા (સર્વથી) અધિક છે (જે) સકલગાત્રજૈઃ સર્વ અંગથી ઉત્પન્ન થયેદા એવા સકલગોપિકાસંગમસ્મરશ્રમજલાણુભિઃ સર્વ જોપીજનના સમાગમથી થયેદા કામ સંબંધી ને શ્રમજલનાં બિંદુઓ તે સાથે સંગમઃ સમાગમ (થાય છે.)

શાખદાર્થ—હે શ્રીલક્ષ્મીલુના સમાન સૌભાગ્યવાળાં અને શ્રી-લગવાનને પ્રિય યમુનાલુ તમારી સ્તુતિ ડોણુ કરી શકે? (ડોઅ નાહ) કારણુ કે શ્રીહરિ સંબંધી ને લક્ષ્મીની સેવા તેણે કરીને મોક્ષપર્યેત સુખ થાય છે, અને તમારી આ માહાત્મ્ય કથા તો સર્વથી અધિક છે કે જે (તમારી સેવા કરવાથી તો તમારા ભક્તને) સર્વ અંગથી ઉત્પન્ન થયેદા એવા સર્વ જોપીજનના સમાગમથી થયેદા કામ સંબંધી ને શ્રમજલનાં બિંદુઓ તેની સાથે સમાગમ થાય છે (લીલાની પ્રાસિ અનુભવ સાથે થાય છે.)

વિવેચન—પૂર્વ ક્ષેત્રાક્ષમાં કંદું કે જ્યારે સર્વવંદ્યા શ્રીગંગા-લુની સ્તુતિ પણ આપના સંબંધ પણીજ થઈ, તો આપની સ્તુતિ કરવામાં ડોણુ સમર્થ છે? તેમાં હેતુ કહે છે કે આપ લક્ષ્મીલુનાં અપલિ છો, અને અર્વ ન્યાનમાં સ્તુત્યતા વાગ્વાતસંબંધથી છે.

તે સંબંધ થીજા સર્વોમાં લક્ષ્મીજીની ન્યૂન છે, તેથી લક્ષ્મીજી અત્યંત સ્તુત્ય છે, અને આપ શ્રીલક્ષ્મીજીનાં સપત્ની (સમાન જૈલાભ્યવાળાં) છો. અહિં એમ શાંકા થાય કે શ્રીલક્ષ્મીજીનાં સપત્ની હોવાથી અત્યંત સ્તુત્યા છે, તો પેહેલાં કણું કે આપની સ્તુતિ કોઈ કરી શકતું નથી તે કેમ ? ત્યાં કહે છે કે જે સપત્ની પણ્યાથી સમાન હોય તો સ્તુતિ થઈ શકે, પરંતુ શ્રીયમુનાજી તો પ્રિયા અર્થાત્ લક્ષ્મીજીની પણ વિશેષ ગ્રેમપાત્ર છે, તેથી તેમની સ્તુતિ અશક્ય છે. હવે ઉપર કણું કે લક્ષ્મીજીની વિશેષ પ્રિય શ્રીયમુનાજી છે. તેનું શું કારણ ? ત્યાં કહે છે કે, પ્રથમ પ્રલુની સેવા કરીને લક્ષ્મીજીની સેવા કરવામાં આવે તો મોક્ષપર્યત સુખ મળે છે, અર્થાત્ પ્રલુસહ લક્ષ્મીજીની સેવાથી મોક્ષ મળે, અને કેવળ લક્ષ્મીજીના સેવનથી મોક્ષ પણ ન મળે, કારણું કે કેવળ લક્ષ્મી મોક્ષનો વિધાત કરે છે. અનુ શાખદનો અર્થ પાછળ થાય છે અર્થાત્ મુખ્ય સેવન પ્રલુનું અને પછી લક્ષ્મીનું એ રીતે કરવાથી મોક્ષમાત્ર મળે છે. અને શ્રીકાલિંગીજીનો ઉત્કર્ષ વિશેષ છે, તે અર્ધ શ્વેષાકથી કહે છે કે આપની કથા મુક્તિથી પણ અધિક છે. અર્થાત્ આપની કથાના રસિક ભક્તજ્ઞનો મોક્ષની પણ હિંદુઓ રાખતા નથી, શ્રીમહલાગવત ષઠ્ઠસ્કંધના નવમ અધ્યાયમાં અથ હ વાવ તવ મહિમાડ્યુતરરસસમુદ્રવિપુષાસકૃદવલીઢ્યા ઇત્યાદિ ગાથ છે.

એમાં કથાપ્રસંગ એ છે કે ભગવાન્ની સ્તુતિ હેવતા કરે છે, ત્યાં કહે છે કે તમારા મહિમારૂપી અમૃતના બિંદુઓ આસ્વાદ કરવાથી દૃષ્ટ અને શ્રુત સુખ જેણે વિસમૃત કરેલાં છે એવા ઐકાંતિક ભક્તજ્ઞનો હોય છે કે જેઓ મોક્ષનો પણ અનાદર કરે છે.

વળી ગોપીજન તથા શ્રીપ્રલુના રસ સંબંધી જે શ્રમ તેથી ઉત્પજ્ઞ થયેલા જે પ્રસ્વેદ જલબિંદુ જે સકળ શરીરમાં જ્વામ તેનો સંબંધ કેને છે, એવાં શ્રીયમુનાજી રાસકીડા સંબંધી છે. તેથી શ્રીયમુનાજીને ભગવત્સંબંધી રસ પરિપૂર્ણ છે, તેથી પોતાનું સેવન કરનારને પણ નેવા કરે છે; જો વાત લક્ષ્મીજીની અધિક કે ચા

‘દૈકમાં પ્રભુના પ્રસ્તેદનું જલ જોતાના જલમાં મદ્દું તેનો સંખંધ
કરાવવારૂપી અયિર્યો સિદ્ધ થણું. ૮

એ પ્રકારે આઠ દૈકવડે શ્રીકાલિંગીલુની સ્તુતિ કરીને આ
સ્તોત્રના પાઠનું ઇલ નવમાં ૧૬૦૩માં કહે છે. યથાપિ શ્રીયમુનાળના
સ્તોત્ર અન્યકૃત છે તેના પાઠ કરતાં આમાં વિશેષ શું? એમ શાંકા
થાય ત્યાં કહે છે કે બીજા સ્તોત્રથી વક્ષ્યમાણું કે ઇલસિદ્ધ તે થતી
નથી તેથી આ સ્તોત્રનોએ પાઠ કરવો ઉચ્ચિત છે. ત્યાં શાંકા થાય
કે બીજા સ્તોત્રથી વક્ષ્યમાણું ઇલ કેમ સિદ્ધ થતું નથી? તેના ઉત્તરમાં
કહે છે કે નેણું સ્વરૂપનું યથાર્થ નિરૂપણ આ સ્તોત્રમાં છે તેણું
અન્ય સ્તોત્રમાં નથી.

મૂલમુ-તવાષ્પકમિદં મુદા પઠતિ સૂરસૂતે સદા

સમસ્તદુરિતક્ષયો ભવતિ વૈ મુકુંદે રતિ.

તયા સકલસિદ્ધયો મુરરિપુશ્ર સંતુષ્યતિ

સ્વભાવવિજયો ભવેદ્રદતિ વલ્લમઃ શ્રીહરે: ॥૧॥

હતિ શ્રીબળભાચાર્યવિરચિતં શ્રીયમુનાષ્કં સંપૂર્ણમ् ॥

સાન્નયપદાર્થઃ—સૂરસૂતે હે સૂર્યનાં પુત્રી (હે શ્રીયમુનાળ) તવ
તમારું ઇદે આ અષ્કમું અષ્ટકને (ને માણુસ) સદા હુમ્મેશ મુદા
હુથેં કરીને પઠતિ પાઠ કરે છે (તે માણુસનાં નિશ્ચયે કરીને)
સમસ્તદુરિતક્ષયઃ સધળાં પાપેનો નાશ ભવતિ થાય છે (અને) મુકુંદે
મુકુંદ (ભગવાન)માં રતિ: પ્રીતિ (થાય છે) તયા તે (પ્રીતિ)
વડે સકલસિદ્ધયઃ સર્વ સિદ્ધિઓ (સિદ્ધ થાય છે) ચ અને મુરરિપુ:
મુરહૈત્યના શત્રુ (ભગવાન) સંતુષ્યતિ જ્ઞાતી રીતે પ્રસન્ન થાય છે (અને)
સ્વભાવવિજયઃ સ્વભાવનો વિજય ભવેતું થાય છે હતિ એ રીતે શ્રીહરે:
શ્રીચુક્ર હુઃખ હુસાર ભગવાનને વલ્લમઃ પ્રિય (એવા શ્રીમદ્ભાગ્વત)

વરતિ કહે છે.

શાસ્ત્રાર્થ:—હે સૂર્યનાં પુત્રી શ્રીયમુનાજુ તમારા આ અષ્ટકને
જે માણુસ હુમેથાં હબે કરીને પાડ કરે છે તે માણુસનાં નિશ્ચયે
કરીને સખળાં પાપેનો નાશ થાય છે. અને મુકુંદ લગ્નવાનમાં પ્રીતિ
થાય છે. તે પ્રતિવ઱ે સર્વ સિદ્ધિઓ સિદ્ધ થાય છે એ સીતે શ્રી
લગ્નવાનને પ્રિય એવા શ્રીમહાપ્રભુજી કહે છે.

વિવેચનઃ—શ્રીયમુનાજુના આ સ્તોત્રના પાડથી સમસ્ત પાપનો
ક્ષય થાય છે. અને તે પછી મોક્ષ આપવાવણા શ્રીપ્રભુમાં પ્રેમ
ઉત્પન્ન થાય છે, અર્થાતું જયારે પાપ ક્ષય થાય ત્યારે પ્રભુ કૃપાપક્ષ-
પાત થાય અને તેથી શ્રીકૃપણુમાં લક્ષ્ણ થાય. કહું છે કે નરાણાં
ક્ષીળિપાપાનાં કૃપ્યો મક્કિઃ પ્રજાયતે “જેનાં પાપનો નાશ થયો છે તે
મનુષ્યને શ્રીકૃપણુની લક્ષ્ણ પ્રાપ્ત થાય છે” તો પ્રથમ પાપ ક્ષય
થયા પછી લક્ષ્ણ થાય. અહિં શાંતા થાય કે પાપ ક્ષય તો જ્ઞાનથી
પણ થાય છે, કેમકે ધીતાજુમાં કહું છે કે “જ્ઞાનામિઃ સર્વકર્માणિ
મહસુતાતું કુસ્તે તથા” અજુન પ્રત્યે લગ્નવાન કહે છે કે જ્ઞાનરૂપ
અમિ સર્વ કર્મને લસ્તમ કરે છે. ત્યાં કહે છે કે જ્ઞાનમાં કલેરા
ધણ્ણો છે, અને આ સ્તોત્રના પાડમાં તેટલો કલેરા નથી, માટે એનો
ઉત્કષ્ટ છે. હવે એમાં કહું કે મુકુંદમાં પ્રીતિ થાય તો મુકુંદ શાષ્ટ્રનો
અર્થ તો મુક્ષિત આપનાર એવો થાય છે, તો લક્ષ્ણ આપનાર એવો
અર્થ શી રીતે? ત્યાં કહે છે કે એ વાત સત્ય પરંતુ શ્રીયમુનાજુના
સ્તોત્રના પાડથી લક્ષ્ણ પણ આપે છે; એથી પ્રભુના સ્વભાવનું
પરાવર્ત્તકપણું સૂચન કર્યું. હવે પ્રભુપદ્ધતિમાં પ્રીતિ થવાથી પૂર્વોક્ત
સક્ષમ સિદ્ધ પ્રાપ્ત થાય છે, અને મુરરિપુ જે લગ્નવાન તે પ્રેસ્ન
થાય છે. અહિં લગ્નવાનનું મુરરિપુ નામ ધરવાનો અલિપ્રાય એ
છે કે કદાચિતું કોઈ પ્રતિબંધ હોય તો આ સ્તોત્રનો પાડ અને તેથી
થતું સ્વેષ્ટ હલ કેમ સિદ્ધ થાય; તે પ્રતિબંધની નિવૃત્ત માટે મુરરિપુ
એ નામ કહું છે. કેમકે નેમ સુરહૈત્ય રાજકન્યાએનો પ્રતિબંધક
હતો, તેને ભારી લગ્નવાને તેમનો પ્રતિબંધ દૂર કરી અંગીકાર કર્યો
તો મજા, કદાચિત ભજાને પ્રતિબંધક મોટ હોય તો તેને દૂર કરી

અતુભૂ કરે; એ સાપન કરવા માટે મુખચિપુ પડ ધર્યુ છે. વે કૃતા-
તરનું સૂચન કરે છે કે સ્વભાવ વિજ્ય થાય, અર્થાતું સ્વભાવ હુદ્ધ
હોય તો તે બદલાઈને જિતમ સ્વભાવ થાય. ત્યાં શાંકા થાય કે એ
વાત તો બહુ કઠિન છે કેમકે સ્વભાવનું બદલાવું તો બહુ તપશ્ચ
કરવાથી થાય તે સ્તોત્ર પાડ ભાગથી કેમ થઈ શકે? અને અર્થશાન
પૂર્વક સ્તોત્ર પાડથી થઈ શકે એમાં પ્રમાણ શું? ત્યાં કહે છે કે જે
જે આત્મવાક્ય છે તે શ્રીમહાપ્રસૂલ કહે છે. ત્યાં સર્દેહ થાય કે એ
વાત બીજા કોઈએ કેમ કહી નથી. ત્યાં કહે છે કે બીજાને શ્રી
પુરુષોત્તમનો સાક્ષાત્કાર નથી, તેથી તે શ્રી રીતે કહી શકે? સાક્ષાત્
સ્વરૂપસંબંધી હોય તેનેજ થાય છે; બીજાને થતું નથી. અને શ્રી
યસુનાળ સાક્ષાત્ સ્વરૂપસંબંધિની છે, એ વાત પ્રથમ કહી છે, તેથી
શ્રીમહાચાર્યશુને શ્રીપુરુષોત્તમનું સાક્ષાત્સ્વરૂપજ્ઞાન છે, અને તેથી
શ્રીયસુનાળના સ્વરૂપનું પણ જાન છે, તેથી શ્રીયસુનાળનું યથાર્થ
નિરૂપણ કર્યુ છે. એ વાતમાં કોઈ વાતની અનુપર્યત્તિ નથી, અર્થાતું
સર્વ પ્રમાણુસિદ્ધ છે. આ નવમા શ્લોકથી પાંચ ક્લાવ બનાવ્યાં. ૧
સર્વ પાપનો નાશ, ૨ મોક્ષ આપવાવાળા શ્રીલગવાન્માં ભાગિત,
તે ભાગિતથી સર્વ ઈષ્ટસિદ્ધ, ૪ દોષનિવારક પ્રલુ પ્રસંગ થાય,
સ્વભાવવિજ્ય એટલે હુદ્ધ સ્વભાવ હોય તે મટીને જિતમ સ્વભાવ
થાય. એથી સંસારમાંથી આસક્તિ છુટે અને પ્રલુપદાદ્રાપરશાગમાં પ્રીતિ
સિદ્ધ થાય છે ॥ ૬ ॥

ઇતિ શ્રીમદ્બૂલભાચાર્યવિરચિતં શ્રીયસુનાષ્કં ગુર્જરટીકા.

સાહિત્ય સંપર્કમ.

三

દાસ સનાથ્ય પ્રાતિષ્ઠ
” ગૈડ ”
સારસ્વત ”
મણુદાસ અંધાલાના
મણુદાસ લાટ મણુરાના
મણુદાસ દીપાન લુહાખુા

ક્ષત્રગાંધી સિંહનંદના
દરદાસની સ્ત્રી વીરભાઈ
કાત્રી અધિપુરી સિંહનંદના
મુતાર અડેલના
કાત્રી અન્ય માર્ગીયનો

१८८

Q12

४. विजयनाथ

૭૨ બાહરાયણુદાસ પુષ્પકરણુા પ્રાણાણ
 ૭૩ સંદુમંડે માણેઠચંદ પાંડે
 ૭૪ નરહરદાસ સંન્યાસી
 ૭૫ ગોપાળદાસ કૃટાખારી
 ૭૬ કૃષ્ણદાસ પ્રાણાણ
 ૭૭ જાતદાસ ચ્યાપડા ક્ષત્રી
 ૭૮ સુંદરદાસ
 ૭૯ માવળ પટેલ તથા તેમના
 સ્ત્રી વીરજા
 ૮૦ ગોપાલદાસ નરેડાના
 ૮૧ સુરદાસળ ગૈઘાટના
 ૮૨ પરમાનંદદાસ કનેણુભા
 પ્રાણાણ
 ૮૩ કુંભનદાસળ
 કુંભનદાસના યેદી કૃષ્ણદાસ
 ૮૪ કૃષ્ણદાસ અધિકારીણ

પુષ્ટિપવાહમર્યાહલેદ	
દુઃસંગવિજાનમેકાર	o-
ઉપદેશશાંકાનિરાસવાદ	o-1
અભિવિધિની	o--
સિદ્ધાંતમુક્તાપદી	o-
શ્રીયમુનાષ્ટક	o-
આલબોધ	o-
અંતઃકરણમોધ	o-
સિદ્ધાંતરહસ્ય	o--
વિવેકધૈર્યાશ્રય	o--
તુલસી	o-
નિરોધલક્ષણ
સેવાકુલ



